



Shashijit Infraprojects Limited
Construction Engineers

T : +91 260 2432963, 78786 60609
E : info@shashijitinfra.com
W : www.shashijitinfra.com

To,
The Department of Corporate Services,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai-400001

02nd August, 2021

Scrip Code : 540147
Security ID : SHASHIJIT

Subject : Newspapers clippings – Notice of 14th Annual General Meeting and instructions for E-voting and other related information.

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of SEBI (LODR) Regulations, 2015, please find attached herewith copy of Newspaper Advertisement confirming dispatch of Notice of 14th Annual General Meeting and instructions for E-voting and other related information.

The Advertisement published in "DAMAN GANGA TIMES" (Gujarati Newspaper) and in "FREE PRESS JOURNAL" (English Newspaper) dated **02nd August, 2021**.

Kindly take the same in your record.

Thanking you.

Yours Faithfully,
For **SHASHIJIT INFRAPROJECTS LIMITED**

(MANTHAN D. SHAH)
Company Secretary
& Compliance Officer
M. No. A42509



Encl. As above

Tenders/ Notices

To Place your Tender/ Notice Ads.

THE FREE PRESS JOURNAL

नवशक्ति

Pls. Call
022- 69028000

DISCLAIMER

The Free Press Journal does not vouch for the authenticity or veracity of the claims made in any advertisement published in this newspaper. Readers are advised to make their own inquiries or seek expert advice before acting on such advertisements.

The printer, publisher, editor and the proprietors of the Free Press Journal Group of newspapers cannot be held liable in any civil or criminal court of law or tribunal within India or abroad for any alleged misleading or defamatory content or claim contained in any advertisement published in this newspaper or uploaded in the epaper on the official website. The liability is solely that of the advertiser in which The Free Press Journal has no role to play.

CHANGE OF NAME

NOTE
Collect the full copy of Newspaper for the submission in passport office.

I HAVE CHANGED MY NAME FROM TANUSHREE SANTOSHKUMAR SHETTY TO TANUSHREE S SHETTY AS PER DOCUMENTS. CL-563

I HAVE CHANGED MY NAME FROM MISS VIDHI KANTIBHAI PATEL TO MRS. VIDHI SHREY VELANI AS PER GOVT. OF MAHARASHTRA GAZETTE NO. (M-2144669). CL-563 A

I HAVE CHANGED MY NAME FROM AKBAR KHAN TO AKBAR ALI AHMED ALI KHAN AS PER DOCUMENTS. CL-563 B

I HAVE CHANGED MY NAME FROM JULEKHABE MOHAMED YASIN TO ZULEKHA MOHD AYUB SHAIKH AS PER DOCUMENTS. CL-563 C

I HAVE CHANGED MY NAME FROM RIZWAN SAYED TO MOHAMMAD RIZWAN SAYED AS PER DOCUMENTS. CL-563 D

I HAVE CHANGED MY NAME FROM HARESH ALIAS LAL SIPPY TO HARESH KHUSHI SIPPY AS PER DOCUMENTS. CL-563 E

I HAVE CHANGED MY NAME FROM MOHAMMAD ANISH SHAIKH TO MOHD. ANISH SHAIKH AS PER DOCUMENTS. CL-563 F

I HAVE CHANGED MY NAME FROM MOHAMMAD AYMAN ANISH SHAIKH TO MOHD AYMAN SHAIKH AS PER DOCUMENTS. CL-563 G

I HAVE CHANGED MY NAME FROM NILESHKUMAR BHUPATRAI MEHTA TO NILESH BHUPATRAI MEHTA AS PER DOCUMENTS. CL-563 H

I SATISH SUDHIR (FATHER) & PROMILA (MOTHER) HAVE CHANGED OUR SON (MINOR) NAME FROM SARANSH TO SARANSH SUDHIR AS PER AFFIDAVIT NO YP 949840 DATED 12TH JULY 2021. CL-731

I HAVE CHANGED MY NAME FROM PROMILA SUDHIR (OLD NAME) TO PROMILA (NEW NAME), AS PER AFFIDAVIT NO YP 949839 DATED 12TH JULY 2021. CL-731 A

I SAY AND DECLARE THAT I AM USING SOME DOCUMENT MY NAME IS VISHRUT BAGMAL ZAVARI AND IN SOME DOCUMENTS MY NAME IS USING VISHRUTH BAGMAL ZAVARI ARE ONE AND SAME PERSON. (VIDE AFFIDAVIT DATED 27 JULY 2021) I FURTHER DECLARE THAT VISHRUT BAGMAL ZAVARI AND VISHRUTH BAGMAL ZAVARI BOTH ARE ONE AND THE SAME PERSON. I.E. MYSELF. CL-857

I SAY AND DECLARE THAT I AM USING SOME DOCUMENT MY NAME IS MEENA VISHRUT ZAVARI AND IN SOME DOCUMENT MY NAME USING MEENABEN VISHRUT ZAVARI FURTHER I DECLARE VIDE AFFIDAVIT DATED 27TH JULY 2021 THAT ABOVE MENTIONED BOTH THE NAMES ARE SAME. I.E. MYSELF. CL-857 A

I HAVE CHANGED MY NAME FROM BUSHRA AJHAHAIDER SAYED TO BUSHRA SOHIL PIRANI AS PER GAZETTE (M-2144400). CL-870

I HAVE CHANGED MY NAME FROM ILIYAS SHAIKH / ILIYAS MOHAMMAD SALIM SHAIKH / ILIYAS SALIM SHAIKH TO MOHD. ILIYAS SHAIKH AS PER DOCUMENT. CL-920

PUBLIC NOTICE
Notice is hereby given to public that Smt. Nalini Chinan Sanghavi herein after referred as my client is the absolute owner of office premises situated 307, Nirma Plaza, Makwana Road, Marol, Andheri (East), Mumbai-400059, herein after referred to as "Said Premises".

The Said Premises was purchased by my client from Mrs. Rama Devi Grover W/o Late Krishanlal Grover executing the agreement for sale on 10.02.2005 and same was registered with Sub Registrar, Andheri-3 vide Sr No. 01529-2005. Subsequently share Certificate No. 038 was issued by Nirma Plaza Premises Co-Op Society Ltd. in her name.

The Said Mrs. Rama Devi Grover and Krishanlal Grover had purchased the said premises from the developer M/s. Shree Varun Enterprises vide Agreement for sale executed on 08.10.1994, and registered with Sub Registrar, Andheri now herein after referred as First Sale Agreement.

The Said First Sale Agreement Original copy has been Lost in transit by office bearer Mr. Pandurang Govind Ingle and same has been reported to MIDC Police Station Andheri Vide N.C. No. 995/2021 on 29.07.2021. All persons hereby informed not to deal or carry out any transaction with any one on the basis of the said missing documents. If anyone has already carried out or being carried out, kindly inform in writing on the below mentioned address within 7 days from this present.

Mr. Chandrakant S Bojgar, Advocate High Court Maharashtra Industrial Compound, Opp. Star Plus, Marol Naka, Andheri (E), Mumbai-400059. Mob.: 9869010842, 8108274324

Place: Mumbai Date: 02.08.2021

PUBLIC NOTICE

My clients, Mr. Mayank Gala and Mrs. Saloni Galahave acquired entire right, title, and interest in Flat No. 12, 6th Floor, Balgandvi, Sri Guruvayurappan Govind Co-operative Housing Society Ltd., Plot No. 549, 11th Road, Chembur, Mumbai 400071 from Mr. Bhaskar Rau, Mr. Balachandra Bhujanga Rau, Mr. Sundep Rau and Mr. Arvind Bhujanga Rau. Any person(s) having right, title, interest or claim of any nature whatsoever in the abovesaid flat is/are requested to submit documentary evidence in support of his/her claim/s within fifteen (15) days from the date of publication of this notice failing which no claims of the members of the public will be binding on my clients.

FROM
ADV. MITHL VINOD SAMPAT
Add: A-901, Sheetalnath, Sudha Park, Gardodia Nagar, Ghatkopar (E), Mumbai - 400 077
Place: Mumbai Date: 02.08.2021

PUBLIC NOTICE

TO WHOMSOEVER IT MAY CONCERN

TAKE NOTICE THAT By this Public Notice may it known to the Public that my Client **Mr. Zuzar A. Kathawala**, residing at **AGH Chambers, 379/381, Narshi Street, Mumbai-400 009** had purchased the **Office No. 502 on 5th Floor, in the society building AGH CHMABERS PREMISES CO-OP. SOCIETY LTD., situated at 379/81, Narshi Street, Mumbai-400 009**, measuring 125. 13 Sq. Meters (Carper) from the vendor **M/s. A. G. H. ENTERPRISES** vide registered SALE DEED dated 25/01/2016 bearing register no. **BBE-1/16/2016**.

NOTICE IS HEREBY GIVEN THAT (1) The Original Sale Agreement dated 03/03/1976 of **Office No. 502 on 5th Floor, in the society building AGH CHMABERS PREMISES CO-OP. SOCIETY LTD., situated at 379/81, Narshi Street, Mumbai-400 009**, measuring 125. 13 Sq. Meters (Carper) AND (2) The Registration Slip of SALE DEED dated 25/01/2016 has been reported lost and misplaced, a police complaint had been lodged with the concerned Police as well.

If any person having any right, title, interest and/or claim of whatsoever nature in or to the said office premises may contact or submit their written claims with supporting bonafide documents to me within 07 days from the publication of this notice, after which any such claim shall be deemed to have been waived.

TAKE FURTHER NOTICE THAT and my client shall take appropriate criminal and civil legal steps/action against such fraudulent person/persons, if any fraudulent and/or forged documents are submitted by them and they shall be dealt with strictly in accordance with the provisions of Law.

MUJAHID SHAKEEL ANSARI
Advocate Bombay High Court
7, Vaswani House, BEST Marg, Near Taj Hotel, Colaba, Mumbai-400 001
Mob.: 9930023859
Email: mamun_ans@yahoo.com

NOTE
Collect the full copy of Newspaper for the submission in passport office.

I HAVE CHANGED MY NAME FROM TANUSHREE SANTOSHKUMAR SHETTY TO TANUSHREE S SHETTY AS PER DOCUMENTS. CL-563

I HAVE CHANGED MY NAME FROM MISS VIDHI KANTIBHAI PATEL TO MRS. VIDHI SHREY VELANI AS PER GOVT. OF MAHARASHTRA GAZETTE NO. (M-2144669). CL-563 A

I HAVE CHANGED MY NAME FROM AKBAR KHAN TO AKBAR ALI AHMED ALI KHAN AS PER DOCUMENTS. CL-563 B

I HAVE CHANGED MY NAME FROM JULEKHABE MOHAMED YASIN TO ZULEKHA MOHD AYUB SHAIKH AS PER DOCUMENTS. CL-563 C

I HAVE CHANGED MY NAME FROM RIZWAN SAYED TO MOHAMMAD RIZWAN SAYED AS PER DOCUMENTS. CL-563 D

I HAVE CHANGED MY NAME FROM HARESH ALIAS LAL SIPPY TO HARESH KHUSHI SIPPY AS PER DOCUMENTS. CL-563 E

I HAVE CHANGED MY NAME FROM MOHAMMAD ANISH SHAIKH TO MOHD. ANISH SHAIKH AS PER DOCUMENTS. CL-563 F

I HAVE CHANGED MY NAME FROM MOHAMMAD AYMAN ANISH SHAIKH TO MOHD AYMAN SHAIKH AS PER DOCUMENTS. CL-563 G

I HAVE CHANGED MY NAME FROM NILESHKUMAR BHUPATRAI MEHTA TO NILESH BHUPATRAI MEHTA AS PER DOCUMENTS. CL-563 H

I SATISH SUDHIR (FATHER) & PROMILA (MOTHER) HAVE CHANGED OUR SON (MINOR) NAME FROM SARANSH TO SARANSH SUDHIR AS PER AFFIDAVIT NO YP 949840 DATED 12TH JULY 2021. CL-731

I HAVE CHANGED MY NAME FROM PROMILA SUDHIR (OLD NAME) TO PROMILA (NEW NAME), AS PER AFFIDAVIT NO YP 949839 DATED 12TH JULY 2021. CL-731 A

I SAY AND DECLARE THAT I AM USING SOME DOCUMENT MY NAME IS VISHRUT BAGMAL ZAVARI AND IN SOME DOCUMENTS MY NAME IS USING VISHRUTH BAGMAL ZAVARI ARE ONE AND SAME PERSON. (VIDE AFFIDAVIT DATED 27 JULY 2021) I FURTHER DECLARE THAT VISHRUT BAGMAL ZAVARI AND VISHRUTH BAGMAL ZAVARI BOTH ARE ONE AND THE SAME PERSON. I.E. MYSELF. CL-857

I SAY AND DECLARE THAT I AM USING SOME DOCUMENT MY NAME IS MEENA VISHRUT ZAVARI AND IN SOME DOCUMENT MY NAME USING MEENABEN VISHRUT ZAVARI FURTHER I DECLARE VIDE AFFIDAVIT DATED 27TH JULY 2021 THAT ABOVE MENTIONED BOTH THE NAMES ARE SAME. I.E. MYSELF. CL-857 A

I HAVE CHANGED MY NAME FROM BUSHRA AJHAHAIDER SAYED TO BUSHRA SOHIL PIRANI AS PER GAZETTE (M-2144400). CL-870

I HAVE CHANGED MY NAME FROM ILIYAS SHAIKH / ILIYAS MOHAMMAD SALIM SHAIKH / ILIYAS SALIM SHAIKH TO MOHD. ILIYAS SHAIKH AS PER DOCUMENT. CL-920

PUBLIC NOTICE
Notice is hereby given to public that Smt. Nalini Chinan Sanghavi herein after referred as my client is the absolute owner of office premises situated 307, Nirma Plaza, Makwana Road, Marol, Andheri (East), Mumbai-400059, herein after referred to as "Said Premises".

The Said Premises was purchased by my client from Mrs. Rama Devi Grover W/o Late Krishanlal Grover executing the agreement for sale on 10.02.2005 and same was registered with Sub Registrar, Andheri-3 vide Sr No. 01529-2005. Subsequently share Certificate No. 038 was issued by Nirma Plaza Premises Co-Op Society Ltd. in her name.

The Said Mrs. Rama Devi Grover and Krishanlal Grover had purchased the said premises from the developer M/s. Shree Varun Enterprises vide Agreement for sale executed on 08.10.1994, and registered with Sub Registrar, Andheri now herein after referred as First Sale Agreement.

The Said First Sale Agreement Original copy has been Lost in transit by office bearer Mr. Pandurang Govind Ingle and same has been reported to MIDC Police Station Andheri Vide N.C. No. 995/2021 on 29.07.2021. All persons hereby informed not to deal or carry out any transaction with any one on the basis of the said missing documents. If anyone has already carried out or being carried out, kindly inform in writing on the below mentioned address within 7 days from this present.

Mr. Chandrakant S Bojgar, Advocate High Court Maharashtra Industrial Compound, Opp. Star Plus, Marol Naka, Andheri (E), Mumbai-400059. Mob.: 9869010842, 8108274324

Place: Mumbai Date: 02.08.2021

PUBLIC NOTICE
Notice is hereby given to public that Smt. Nalini Chinan Sanghavi herein after referred as my client is the absolute owner of office premises situated 307, Nirma Plaza, Makwana Road, Marol, Andheri (East), Mumbai-400059, herein after referred to as "Said Premises".

The Said Premises was purchased by my client from Mrs. Rama Devi Grover W/o Late Krishanlal Grover executing the agreement for sale on 10.02.2005 and same was registered with Sub Registrar, Andheri-3 vide Sr No. 01529-2005. Subsequently share Certificate No. 038 was issued by Nirma Plaza Premises Co-Op Society Ltd. in her name.

The Said Mrs. Rama Devi Grover and Krishanlal Grover had purchased the said premises from the developer M/s. Shree Varun Enterprises vide Agreement for sale executed on 08.10.1994, and registered with Sub Registrar, Andheri now herein after referred as First Sale Agreement.

The Said First Sale Agreement Original copy has been Lost in transit by office bearer Mr. Pandurang Govind Ingle and same has been reported to MIDC Police Station Andheri Vide N.C. No. 995/2021 on 29.07.2021. All persons hereby informed not to deal or carry out any transaction with any one on the basis of the said missing documents. If anyone has already carried out or being carried out, kindly inform in writing on the below mentioned address within 7 days from this present.

Mr. Chandrakant S Bojgar, Advocate High Court Maharashtra Industrial Compound, Opp. Star Plus, Marol Naka, Andheri (E), Mumbai-400059. Mob.: 9869010842, 8108274324

Place: Mumbai Date: 02.08.2021

PUBLIC NOTICE
Notice is hereby given to public that Smt. Nalini Chinan Sanghavi herein after referred as my client is the absolute owner of office premises situated 307, Nirma Plaza, Makwana Road, Marol, Andheri (East), Mumbai-400059, herein after referred to as "Said Premises".

The Said Premises was purchased by my client from Mrs. Rama Devi Grover W/o Late Krishanlal Grover executing the agreement for sale on 10.02.2005 and same was registered with Sub Registrar, Andheri-3 vide Sr No. 01529-2005. Subsequently share Certificate No. 038 was issued by Nirma Plaza Premises Co-Op Society Ltd. in her name.

The Said Mrs. Rama Devi Grover and Krishanlal Grover had purchased the said premises from the developer M/s. Shree Varun Enterprises vide Agreement for sale executed on 08.10.1994, and registered with Sub Registrar, Andheri now herein after referred as First Sale Agreement.

The Said First Sale Agreement Original copy has been Lost in transit by office bearer Mr. Pandurang Govind Ingle and same has been reported to MIDC Police Station Andheri Vide N.C. No. 995/2021 on 29.07.2021. All persons hereby informed not to deal or carry out any transaction with any one on the basis of the said missing documents. If anyone has already carried out or being carried out, kindly inform in writing on the below mentioned address within 7 days from this present.

Mr. Chandrakant S Bojgar, Advocate High Court Maharashtra Industrial Compound, Opp. Star Plus, Marol Naka, Andheri (E), Mumbai-400059. Mob.: 9869010842, 8108274324

Bank of Baroda
CBD Belapur Branch, Bank of Baroda, Monarch Plaza, Shop No 12 & 13, Plot no056, Sector 11, CBD Belapur, Navi Mumbai 400614.

POSSESSION NOTICE (Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002)

Whereas, The undersigned being the Authorized Officer of Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 8, 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 03/04/2021 calling upon the borrowers/guarantors Mr. Yogesh Klean Thorat, Joint Borrower Mrs. Pooja Yogesh Thorat and also owner of the property /surety to repay the amount mentioned in the Notice being: '1 With Ac No: 2766060004850 for Rs. 14,40,191.33/- for Rupees Fourteen Lakhs Four Thousand One Hundred Ninety One and Thirty Three Paise only) 2) With Ac No: 2766060005070 for Rs. 9,17,480.57/- (Rupees Nine Lakhs Seventeen Thousand Four Hundred Eighty and Fifty Seven Paise only) As on 03/04/2021 with future interest thereon at contractual rate due from + Penal Interest, Incidental Expenses, Bank charges etc within 60 days from the date of the said notice.

As the borrower / guarantors / mortgagors have failed to repay the amount, notice is hereby given to the borrower / guarantors / mortgagors of the property and the public in general that the undersigned has taken Symbolic Possession of the property mortgaged to the Bank, described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 9 of the said rules on this 30th day of July of the year 2021.

The borrowers / guarantors / mortgagors in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda CBD Belapur Branch for an amount (1) With Ac No: 2766060004850 for Rs. 14,40,191.33/- for Rupees Fourteen Lakhs Four Thousand One Hundred Ninety One and Thirty Three Paise only) 2) With Ac No: 2766060005070 for Rs. 9,17,480.57/- (Rupees Nine Lakhs Seventeen Thousand Four Hundred Eighty and Fifty Seven Paise only) As on 03/04/2021 with future interest thereon at contractual rate due from + Penal Interest, Incidental Expenses, Bank charges etc till realization.

Description of the Immovable Property
with Ac No: 2766060004850 & 2766060005070 Flat No. A-106, First Floor, Vastu Shanti CHS Ltd, Plot No. 13, Sector-11, Road Pali, Kalina - 410218

Sd/-
Date : 30.07.2021 Authorized Officer
Place : Roadpali, Panvel Taluka Bank of Baroda, Cdb Belapur Branch

NEW INDIA CO-OPERATIVE BANK LTD.
(Multistate Scheduled Bank)

Corporate Office: New India Bhawan, A.V. Nagwaker Marg, Prabhadevi, Mumbai - 400025.

NI/COOP/0301401000031/176/2021-2022 Date: 10.06.2021

NOTICE US 13(2) OF SECURITISATION & RECONSTRUCTION OF FINANCIAL ASSETS & ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

To, 1. Mr. Arun Shivprasad Singh Borrower
Flat No. 704, 7th Floor, "A" Wing, Zain Heights Building, Samel, Nallasopara (W), Taluka Vasai Dist. Palghar - 401203.

2. Mr. Keshman Ramanand Singh Surety
D/504, Sumit Green Dale NX, Chikhaldongri Road, Global City, Virar (W), Dist. Palghar - 401203.

Ref. Your Housing Loan Account No. 03014010000031 with our Shanti Park, Mira Road (E) Branch.

1. M/s. New India Co-operative Bank Ltd. (herein after referred to as the Bank) having its Branch at Shanti Park, Mira Road (E) sanctioned Housing Loan facility (herein after referred to as the "said Credit Facility") of Rs. 21,00,000/- (Rupees Twenty One Lakh Only) on the terms and conditions contained in the Sanction Letter mentioned herein below to you No. 1 and you No. 2. Have guaranteed repayment of the amount due and payable under the said Credit Facility with interest, costs, charges and expenses as guarantors. The details of the Sanction Letter and the Credit Facility is as under:

Sanction letter No. & Date	Type of facility	Amount sanctioned (Rs in Lakh)	Security
NI/CREDIT/439/2019-20 dated 29.11.2019	Housing Loan	21.00	Equitable Mortgage Charge on Flat No. 704, 7th Floor, "A" Wing, Zain Heights Building situated at Samel, Nallasopara (W), Taluka Vasai Dist. Palghar - 401 203, measuring 700 Sq. Ft. Equivalent to 65.05 Sq. Mtrs. Built up Area

2. You No. 1 have created Equitable mortgage charge on the following property, in favor of the Bank to secure repayment of the amount due and payable under the said Credit facility together with interest, costs, charges and expenses. You have also deposited the original title deeds of the property and executed necessary documents to create charge on the said property.

The details of the property mortgaged is as under-
Equitable Mortgage Charge on Flat No. 704, 7th Floor, "A" Wing, Zain Heights Building situated at Samel, Nallasopara (W), Taluka Vasai Dist. Palghar - 401 203, measuring 700 Sq. Ft. Equivalent to 65.05 Sq. Mtrs. Built up Area

3. You Nos. 1 to 2 have defaulted in repayment of the amount due and payable under the said Credit facility in spite of repeated requests and reminders and therefore the account has been classified as **Non-Performing Asset with effect from 31.03.2021 as per the Guidelines of Reserve Bank of India on IRAC norms.**

4. The outstanding balance amount due and payable to the Bank as on date under the aforesaid loan together with future interest are as under:

Loan Account No.	Amount outstanding Balance	Future interest
03014010000031	Rs. 23,08,226.76	@8.75% p.a. compounded with monthly rest w.e.f. 01.04.2021 and penal interest @ 2% p.a. On simple rate of interest.

5. You Nos. 1 to 2 are hereby called upon to pay the sum of **Rs. 23,08,226.76 (Rupees Twenty Three Lakh Eight Thousand Two Hundred Twenty Six & Paise Sixty Five Only)** together with future interest thereon at the rate herein above mentioned within 60 days from the date hereof, failing which Bank shall take steps for enforcement of security interest of the Bank in the mortgaged properties mentioned herein above under the provisions of the "SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 which please note.

6. The amount due and payable to the Bank under the said loan is secured by mortgage over properties mentioned herein above. With effect from receipt of the aforesaid notice you are directed not to deal with, encumber, sale, transfer, assign and/or create third party's rights of any nature whatsoever in or upon the said mortgaged property or any part thereof.

7. This notice is without prejudice to the Bank's right to initiate/continue such other actions and/or legal proceedings, as it deems fit and necessary under provisions of any other law.

Yours faithfully,
Authorized Officer

THE SAHYADRI SAHAKARI BANK LTD., MUMBAI
Registered Office: 446, J.S.S. Road, Mumbai - 400 002.
Branch Office at 5/7, Vijaywadi, J.S.S. Road, Chira Bazar Branch, Mumbai - 400 002.
Tel: (022)-2205 4643/ 2201 7477/ 2201 6770
E-mail: recovery@thesahyadribank.com / sahyadri@rediffmail.com

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)
(As per Appendix IV read with Rule 8 (1) of the Security Interest (Enforcement) Rules, 2002)

Whereas, The undersigned being the Authorized officer of The Sahyadri Sahakari Bank Ltd., Mumbai having its Registered Office at 446, J.S.S. Road, Mumbai - 400 002 and Branch Office at 5/7, Vijaywadi, J.S.S. Road, Chira Bazar Branch, Mumbai - 400 002 under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("SARFAESI Act") and in exercise of Powers conferred under Section 13 (2) and 13 (12) read with rule 8 (1) of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 16TH April 2021 by Registered A/D on 16.04.2021 & acknowledged on 21.04.2021 having Address at

1) Mr. POPAT DHANSHING KADAM (Borrower- HYPTL LOAN A/c No. 1003181400000055 & CC/GENI/CC A/c No. 100219940004589) Having Address At: 3/30, Corner View Building, Gokhale Road, Dadar (W), Mumbai - 400 028

2) Mr. DEEPAK BABURAO JADHAV (Guarantor - 1) Having Address At: 13, Parshuram Building, Ram Maruti Road, Dadar, (W), Mumbai - 400 028

3) Mr. AJIT DHANSHING KADAM (Guarantor-2) Having Address At: R. No. 102, Vaishnavi Ornament, Sector - 26, Koprigao, Navi Mumbai - 400 603

to repay the amount mentioned in the notice being HYPTL Loan A/c No. - 1003181400000055 - Rs. 57,75,905/- (Rupees Fifty Seven Lakhs Seventy Five Thousand Nine Hundred Five Only) as on 31st March 2021 & CC/GENI/CC A/c No. - 100219940004589 - Rs. 57,83,314/- (Rupees Fifty Seven Lakhs Eighty Three Thousand Three Hundred Fourteen Only) as on 31st March 2021 together with further interest and other charges thereon at the contractual rates upon the footing of compound interest till its actual realization (outstanding amount) within 60 days from the date of receipt of the said notice.

The aforementioned Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the SARFAESI Act read with Rule 8 of the above said rules on this 25th day of June of the year 2021.

The Borrower/ Guarantor mentioned hereinabove in the particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the THE SAHYADRI SAHAKARI BANK LTD., MUMBAI having branch address at 5/7, Vijaywadi, J.S.S. Road, Chira Bazar Branch, Mumbai - 400 002 for an amount of HYPTL Loan A/c No. - 1003181400000055 - Rs. 57,75,905/- (Rupees Fifty Seven Lakhs Seventy Five Thousand Nine Hundred Five Only) as on 31st March 2021 & CC/GENI/CC A/c No. - 100219940004589 - Rs. 57,83,314/- (Rupees Fifty Seven Lakhs Eighty Three Thousand Three Hundred Fourteen Only) as on 31st March 2021 together with further interest and other charges thereon at the contractual rates upon the footing of compound interest till its actual realization (outstanding amount) within 60 days from the date of receipt of the said notice.

The aforementioned Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the SARFAESI Act read with Rule 8 of the above said rules on this 25th day of June of the year 2021.

The Borrower/ Guarantor mentioned hereinabove in the particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the THE SAHYADRI SAHAKARI BANK LTD., MUMBAI having branch address at 5/7, Vijaywadi, J.S.S. Road, Chira Bazar Branch, Mumbai - 400 002 for an amount of HYPTL Loan A/c No. - 1003181400000055 - Rs. 57,75,905/- (Rupees Fifty Seven Lakhs Seventy Five Thousand Nine Hundred Five Only) as on 31st March 2021 & CC/GENI/CC A/c No. - 100219940004589 - Rs. 57,83,314/- (Rupees Fifty Seven Lakhs Eighty Three Thousand Three Hundred Fourteen Only) as on 31st March 2021 together with further interest and other charges thereon at the contractual rates upon the footing of compound interest till its actual realization (outstanding amount) within 60 days from the date of receipt of the said notice.

The aforementioned Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the SARFAESI Act read with Rule 8 of the above said rules on this 25th day of June of the year 2021.

The Borrower/ Guarantor mentioned hereinabove in the particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the THE SAHYADRI SAHAKARI BANK LTD., MUMBAI having branch address at 5/7, Vijaywadi, J.S.S. Road, Chira Bazar Branch, Mumbai - 400 002 for an amount of HYPTL Loan A/c No. - 1003181400000055 - Rs. 57,75,905/- (Rupees Fifty Seven Lakhs Seventy Five Thousand Nine Hundred Five Only) as on 31st March 2021 & CC/GENI/CC A/c No. - 100219940004589 - Rs. 57,83,314/- (Rupees Fifty Seven Lakhs Eighty Three Thousand Three Hundred Fourteen Only) as on 31st March 2021 together with further interest and other charges thereon at the contractual rates upon the footing of compound interest till its actual realization (outstanding amount) within 60 days from the date of receipt of the said notice.

The aforementioned Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the SARFAESI Act read with Rule 8 of the above said rules on this 25th day of June of the year 2021.

The Borrower/ Guarantor mentioned hereinabove in the particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the THE SAHYADRI SAHAKARI BANK LTD., MUMBAI having branch address at 5/7, Vijaywadi, J.S.S. Road, Chira Bazar Branch, Mumbai - 400 002 for an amount of HYPTL Loan A/c No. - 1003181400000055 - Rs. 57